



રાજકોટ મહાનગરપાલિકા - શહેરી મેલેરિયા યોજના

ડૉ. આંબેડકરભાવન રૂમ નં. ૬, ત્રીજો માળ, બસ સ્ટેન્ડની પાસે,
ઢેબરભાઈ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૨.



☎ : 0281 - 2237062

✉ : biologist_rmc@yahoo.in

👍 Like us on Facebook : /malaria.department

☎ : 8866156112

તા. ૧૦/૧૦/૨૦૧૯

પ્રતિ,
તંત્રીશ્રી,

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના મેલેરિયા વિભાગ દ્વારા ન્યુ પી.જી. હોસ્ટેલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વાહકજન્ય રોગચાળા અટકાયતી પગલાંની સઘન કામગીરી

ન્યુ પી.જી. હોસ્ટેલમાં તથા સિવિલ હોસ્પિટલના દરેક વોર્ડમાં મચ્છરના લાર્વા (પોરા) માટે દરેક વોર્ડ તથા વિભાગ સઘન ચેકીંગ તથા પોરાનાશક કામગીરી

ઓલ્ડ લેન્ડ માર્કે (કોમ્પ્લેક્ષ) - એસ્ટ્રોન ચોક, પ્રાઇડ એમ્પાયર (બાંધકામ સાઇટ) - રેસકોર્ષ રીંગરોડ, બી.એસ.એન.એલ. ઓફિસ - ૮૦ ફુટ રોડ, કોટક સાયન્સ સ્કૂલ - ધર્મેન્ડ કોલેજ રોડ, લાખાજીરાજ હોસ્ટેલ, રીલાયન્સ પેટ્રોલ પંપ - ૮૦ ફુટ રોડ, સરદાર ઇન્ડસ્ટ્રીઝ - ૮૦ ફુટ રોડ ખાતે મચ્છર ઉત્પતિ સબબ નોટીસ

વરસાદની ઋતુ ની વિદાય બાદ મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્ગ્યુ કેસો જોવા મળે છે. ડેન્ગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ રહે છે. ખાસ કરીને લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્પતિ ઘણી વધી જાય છે.

સિવિલ હોસ્પિટલ અને ન્યુ પી.જી. હોસ્ટેલમાં વાહકજન્ય રોગચાળો ન ફેલાય તેના અટકાયતી પગલારૂપે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલની સુચના અનુસાર આરોગ્ય અધિકારીશ્રી ડો. પંકજ રાઠોડના માર્ગદર્શન હેઠળ, બાયોલોજીસ્ટ તથા સેન્ટ્રલ ઝોન મેલેરિયા શાખાની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવેલ હતી

સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન દરેક વોર્ડ તથા દરેક વિભાગ ના બાથરૂમમાં રાખેલ પાણીના પ્લાસ્ટીક બેરલ તથા ડોલમાં મચ્છર ઉત્પત્તિ જોવા મળી આવેલ, આ ઉપરાંત

કુલ - છોડનાં કુંડ, વોટરકુલર, ફિજની ટ્રે, અગાસી તથા અન્ય જગ્યાઓએ રાખેલ ભંગારમાં મચ્છર ઉત્પત્તિ મળી આવેલ.

ન્યુ પી.જી. હોસ્ટેલ ખાતે અગાશી પર પડેલ ભંગારમાં તથા ઓવર ફ્લોથી જમા પાણીમાં મચ્છર ઉત્પત્તિ મળી આવેલ, વોટર ફૂલરના ફિલ્ટરમાં તથા ન્યુ પી.જી. હોસ્ટેલની મેસની અંદર ફિજની ટ્રે, પાણીની ડોલ, મચ્છર ઉત્પત્તિ મળી આવેલ.

આ ઉપરાંત ગત સપ્તાહ દરમિયાન મચ્છર ઉત્પત્તિ સબબ ચેકિંગ દરમિયાન ઓલ્ડ લેન્ડ માર્કે (કોમ્પ્લેક્ષ) - એસ્ટ્રોન ચોક અને પ્રાઇડ એમ્પાયર (બાંધકામ સાઇટ) - રેસકોર્ષ રીંગરોડ ખાતે મચ્છર ઉત્પત્તિ સબબ વહિવટી ચાર્જ વસુલાત કરેલ છે તથા બી.એસ.એન.એલ. ઓફિસ - ૮૦ ફુટ રોડ, કોટક સાયન્સ સ્કૂલ - ધર્મેન્ડ કોલેજ રોડ, મ રીલાયન્સ પેટ્રોલ પંપ - ૮૦ ફુટ રોડ, રવિ હોસ્ટેલ - સર્વોદય સોસા., શ્રીજી હોસ્ટેલ - સરદારનગર, લાખાજીરાજ હોસ્ટેલ, સમુદ્ધિ એપાર્ટમેન્ટ, સંસ્કૃતિ એપાર્ટમેન્ટ - મેહુલનગરની બાંધકામ સાઇટ, પ્રેડ ફિલ્ડ ઇન્ડિયા - આજી વસાહત, ગીના વાયર પ્રોડક્ટ - આજી વસાહત, સરદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર - ૮૦ ફુટ રોડ ખાતે મચ્છર ઉત્પત્તિ મળી આવતા નોટીસ આપેલ છે.

ડેન્જ્યુ અટકાયતી માટે એડિસ મચ્છરની ઉત્પત્તિ અટકાવવી ખુબજ આવશ્યક છે. ફોગીંગએ એક માત્ર ઉપાય નથી. ફોગીંગ ફક્ત ચેપી પુખ્ત મચ્છરના નાશ માટે જરૂરી છે. મચ્છરની ઉત્પત્તિ જ ચાલુ જ રહે તો ફોગીંગનો હેતુ સિદ્ધ થતો નથી. આથી મચ્છરનાલાવાં (પોરા) નો નાશ કરવો, એ ખુબ જ આવશ્યક છે. આથી ડેન્જ્યુ રોગ અટકાયતી ઝુંબેશમાં મહાનગરપાલિકાના પ્રયત્નોમાં સૌ સાથે મળીને સહકાર આપો .

આરોગ્યઅધિકારી
રાજકોટ મહાનગરપાલિકા

